



Halaal Tariqe Se Kamaane Ke 50 Madani Phool (Gujarati)

હલાલ તરીકે સે કમાને કે 50 મ-દની ફૂલ

શૈળે ટ્રેડિંગ, અમેરિકા સુપરાર્ટ, બાનિયે દા'વતે કલાકારી, છાચત આલામ મૌલાના જાથુ મિલાન
મુહમ્મદ બલ્યાસ અતાર કાઉરી ૨-૫૫૧
કાન્ટેચરિયલ
સાઇટ

الْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعَالَمِينَ وَالصَّلٰوةُ وَالسَّلَامُ عَلٰى سَيِّدِ الْمُرْسَلِينَ
أَمَّا بَعْدُ فَاعُوذُ بِاللّٰهِ مِنَ الشَّيْطَنِ الرَّجِيمِ يَسْمِعَ اللّٰهُ الرَّحْمٰنُ الرَّحِيمُ
کیتاں پہنے کی جاؤ

આજ : શૈખે તરીકત, અમીરે અહલે સુન્નત, બાનિયે દા'વતે ઈસ્લામી, હજરત અલ્લામા મૌલાના અબૂ બિલાલ મુહમ્મદ ઈલ્�યાસ અતાર કાફિરી ૨-ઝવી ૧૪૭૫

ਇੰਨੀ ਕਿਤਾਬ ਯਾ ਈਸ਼ਾਮੀ ਸਬਕ ਪਥਨੇ ਸੇ ਪਛਲੇ ਮੈਲ ਮੌਦੂ ਹੁਆ ਪਥ ਵਿਖਿਏ ਅਤੇ ਕੁਝ ਪਛੋਂਗੇ ਧਾਰ ਰਹੇਗਾ। ਹੁਆ ਧੇਹ ਹੈ :

اللهم افتح علينا حكمتك وانشر
علينا رحمتك يا ذا الجلال والأكرام

તરજમા : એ અલ્લાહ ! ગુરૂજ ! હમ પર ઇલ્મો હિકમત કે દરવાજે ખોલ દે એંબું હમ પર અપની રહમત નાભિલ ફરમા ! એ-જમત ઔર બુઝુગ્ગી વાલે. (المُسْتَرِّج أص، دارالنکر بیروت)

નોટ : અવ્યાલ આભિર એક એક બાર દુર્ગં શરીફ પઠ લીજિયે

તાલિબે ગમે મદીના
વ બક્કીએ
વ મહિફરત
13 શવ્યાલુલ મુકર્રમ 1428 હિ.



ਛਲਾਲ ਤਰੀਕੇ ਸੋ ਕਮਾਨੇ ਕੇ 50 ਮ-ਦਨੀ ਫੁਲ

યેહ રિસાલા (હલાલ તરીકે સે કમાને કે 50 મ-દની ફૂલ)

શૈખે તરીકત, અમીરે અહલે સુન્નત, બાનિયે દા'વતે ઈસ્લામી હજરત અલ્લામા મૌલાના અબુ બિલાલ મુહમ્મદ ઈલ્યાસ અતાર કાંદિરી ૨-ઝવી જિયાઈ ને દામેટ રોકન્ફેમ ગાળીએ.

મજલિસે તરાજિમ (દા'વતે ઈસ્લામી) ને ઈસ રિસાલે કો ગુજરાતી રસ્મુલ ખત મેં તરતીબ દે કર પેશ કિયા હૈ ઔર મક-ત-બતુલ મદીના સે શાઅએ કરવાયા હૈ. ઈસ મેં અગર કિસી જગહ કમી બેશી પાણે તો મજલિસે તરાજિમ કો (બ જરીએ મકતૂબ, ઈ-મેઈલ યા SMS) મુજલાય ફરમા કર સવાબ કુમાઈયે.

રાબિતા : મજલિસે તરાજિમ (દા'વતે ઈસ્લામી)

મક-ત-બતુલ મહીના, સિલેક્ટેડ હાઉસ, અલિફ કો માર્કેટને,
તીન દરવાજા, અહુમદાબાદ-૧, ગુજરાત, ઇન્ડિયા

الْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعَالَمِينَ وَالصَّلٰوةُ وَالسَّلَامُ عَلٰى سَيِّدِ الْمُرْسَلِينَ
آتَاهُمْ بَعْدَ فَاعْوَذُ بِاللّٰهِ مِنَ الشَّيْطَنِ الرَّجِيمِ بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيمِ

ਛਲਾਲ ਤਰੀਕੇ ਸੋ ਕਮਾਨੇ ਕੇ 50 ਮ-ਈਨੀ ਫੁਲ

શૈતાન લાખ રોકે મગર યેહ રિસાલા (23 સફણત) મુક્કમલ પઢ કર અપની આખિરત કા ભલા કીજિયે.

ਦੂਜੇ ਸ਼ਰੀਕ ਕੀ ਫਾਈਲਤ

امیل مُعَمِّنی نے ہمارتے سایہ ہونا ابھو بک سیدیک
رضا اللہ تعالیٰ عنہ سے ریواخت ہے کے نبیتے کریم، رغیب رحیم
علیہ افضل الصّلوات والسلیم پر دُرود پاک پڑنا گرانا ہوئے کو یہ س کدر ۷۶۷ میتا تا
ہے کے پانی بھی آغا کو ۳۵ نویں بُو جاتا اور نبی
صلی اللہ تعالیٰ علیہ وآلہ وسلم پر سلام بے چنان گرد نے (یا' نی گولاب ماؤں کو)
آزاد کرنے سے افسوس لے ہے۔ (تاریخ بغداد ج ۷ من ۱۲۲)

صَلُّوا عَلَى الْحَبِيبِ! صَلَّى اللَّهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! જિસ કો મુલાજિમ રખના હૈ ઉસે
મુલાજિમ રખને કે ઔર જિસ કો મુલા-જમત કરની હૈ ઉસે મુલા-જમત કે
જરૂરી અહેકમ જાનને ફરજ હૈનું. અગર હસ્બે હાલ નહીં સીએગા તો શુનહગાર
ઔર અગાબે નાર કા હક્કદાર હોગા ઔર ન જાનને કી વજહ સે બાર બાર
ગુનાહોં કા ઈન્જિલા મજીદ બરાઓં (યા'ની ઈસ કે ઈલાવા). ઈસ રિસાલે મેં
સિર્જ ચીદા ચીદા મસાઈલ દર્જ કિયે ગયો હૈ મજીદ મા'લૂમાત કે લિયે
“બહારે શરીઅત” જિલ્લ 3 સર્ફણા 104 તા 184 પર “ઈજારે કા બયાન”

غزوہ عمل (ع) پر دس رکھ مانے مुسٹکا : جس نے میں پر ایک بار ہڑتے پاک پشا اعلیٰ والوں اور مسلم رہنمائی بے جاتا ہے۔ (۱)

ਪਛ ਲੀਜਿਥੇ, ਪਹਲੇ ਹਲਾਲ ਰੋਜ਼ੀ ਕੀ ਫ਼ਜ਼ੀਲਤ ਔਰ ਹਰਾਮ ਰੋਜ਼ੀ ਕੀ ਤਬਾਅ ਕਾਰਿਆਂ ਮੁੱਖ ਸਰਨ ਪੇਸ਼ ਕੀ ਜਾਂਦੀ ਹੈ, ਅਲਵਾਹ ਤਬਾ-2-ਕ ਵ ਤਅਾਲਾ 12ਵੇਂ ਪਾਰੇ ਕੀ ਪਛਲੀ ਆਯਤ ਮੌਂ ਈਰਾਂਦ ਫਰਮਾਤਾ ਹੈ :

تર-۴-માં કન્ગુલ ઈમાન : ઔર જમીન પર
ચલને વાલા કોઈ ઐસા નહીં જિસ કા રિઝૂક
અલ્લાહ કે જિયાંમાં કુરમ પર ન હો.

ਮੁਫ਼ਸਿਸ਼ ਰੇ ਸ਼ਹੀਰ ਛਕੀਮੁਲ ਉਮਮਤ ਹਜ਼ਰਤੇ ਮੁਝਤੀ ਅਹਮਦ ਧਾਰ ਖਾਨ
 “ਨੂਰੁਲ ਈਰਫ਼ਾਨ” ਮੇਂ ਫਰਮਾਤੇ ਹਨ : ਜਮੀਨ ਪਰ ਚਲਨੇ ਵਾਲੇ ਕਾ
 ਇਸ ਲਿਖੇ ਤ੍ਰਿਕ ਫਰਮਾਯਾ ਕੇ ਹਮ ਕੋ ਇਨ੍ਹਾਂ ਕਾ ਮੁਸ਼ਾ-ਹਦਾ ਹੋਤਾ ਹੈ (ਧਾਰ ਨੀ
 ਨਜ਼ਰ ਆਤੇ ਹੋ) ਵਰਨਾ ਜਿੱਨਾਤ ਵਗੈਰਾ ਕੋ (ਭੀ) ਰਖ (ਗੁਰੂ ਜੀ) (ਹੀ) ਰੋਜ਼ੀ
 ਦੇਤਾ ਹੈ। ਉਸ ਕੀ ਰਖ਼ਆਕਿਥਤ ਸਿੰਘ ਹੈਵਾਨਾਂ ਮੇਂ ਮੁਞਦਸਿਰ ਨਹੀਂ, ਫਿਰ ਜੋ ਜਿਸ
 ਰੋਜ਼ੀ ਕੇ ਲਾਈਕ ਹੈ ਉਸ ਕੀ ਵੋਖੀ ਮਿਲਤੀ ਹੈ। ਬਚ੍ਚੇ ਕੋ ਮਾਂ ਕੇ ਪੇਟ ਮੇਂ ਆਂਦੇ ਹਨ ਕਿਸਮ
 ਕੀ ਰੋਜ਼ੀ ਮਿਲਤੀ ਹੈ ਆਂਦੇ ਹਨ ਕੇ ਬਾਏ ਦਾਂਤ ਨਿਕਲਨੇ ਦੇ ਪਛਲੇ ਆਂਦੇ ਤਰਹ
 ਕੀ, ਬੇਤੇ ਹੋ ਕਰ ਆਂਦੇ ਤਰਹ ਕੀ। (ਨੂਰੁਲ ਈਰਫ਼ਾਨ, ਸ. 353 ਬਿਤਗਯੂਰ ਕਲੀਲ)

﴿1﴾ सब से जियादा पाइजा खाना वोह है जो अपनी कमाई से खाओ।
﴿2﴾ बेशक अल्लाह तआला मुसल्मान पेशावर को दोस्त रखता है।
﴿3﴾ जिसे मजदूरी से थक कर शाम आओ उस की वोह शाम, शामे मण्डिरत हो।
﴿4﴾ पाक कमाई वाले के लिये जन्नत है। **﴿5﴾** कुछ गुनाह ऐसे हैं जिन का कफ़ारा न नमाज हो न रोज़े न हज़ न उम्रह। उन का कफ़ारा वोह परेशानियां होती हैं जो आदमी को तलाशे मआशे उलाल में पहोंचती हैं।

١٧ ترجمة ج ٣ ص ٧٦ حديث ١٣٦٣ مجمّع أو سطح أص ٢٢٧ حديث ٨٩٤٣ م ٣٣٧

٤٦١٦ حديث ٧٥٢. إيضاحاً

5 : ۱۰۲ حدیث ۴۲ ص ۱ اپنے ۲-۳ ویاوا، جی. 29، س. 314 تا 317

﴿ ફરમાને મુસ્તાક। ﴾ : ﷺ જો શાખ્સ મુજ પર દુરેદે પાક પઢના ભૂલ ગયા વોહ જન્નત કા રાસ્તા ભૂલ ગયા. (بخاري)

લુકમાંએ હલાલ કી ફરીલત

હમેં હમેશા હલાલ રોગી કમાના, ખાના ઔર બિલાના ચાહિયે લુકમાંએ હલાલ કી તો ક્યા હી બાત હૈ ચુનાન્યે દા'વતે ઈસ્લામી કે ઈશાઅતી ઈદારે મક-ત-બતુલ મદીના કી મત્બૂઆ 1548 સફાત પર મુશ્તમિલ કિતાબ, “ફેઝાને સુન્નત” જિલ્દ અવ્યલ સફહા 179 પર હૈ : હજરતે સથિદુના ઈમામ મુહમ્મદ ગંગાલી عَلَيْهِ رَحْمَةُ اللَّهِ الْوَالِي ઓહયાઉલ ઉલ્દૂમ કી દૂસરી જિલ્દ મેં એક બુગુરી عَلَيْهِ رَحْمَةُ اللَّهِ الْوَالِي કા કૌલ નકલ કરતે હોય કે મુસલ્માન જબ હલાલ ખાને કા પહેલા લુકમા ખાતા હૈ, ઉસ કે પહેલે કે ગુનાહ મુઆફ કર દિયે જાતે હોય. ઔર જો શાખ્સ ત-લબે હલાલ કે લિયે રૂસ્વાઈ કે મકામ પર જાતા હૈ ઉસ કે ગુનાહ દરખ્ત કે પત્રોં કી તરફ ઝડતે હોય.

(احિયા التلمુج ٢ ج ١١٦ ص)

હરામ રોગી કે બારે મેં 4 ફરામીને મુસ્તાક।

صَلَّى اللَّهُ تَعَالَى عَلَيْهِ وَاللَّهُ وَسَلَّمَ

﴿1﴾ એક શાખ્સ તવીલ સફર કરતા હૈ જિસ કે બાલ પરેશાન (બિખરે હુએ) હોય ઔર બદન ગર્દ આલૂદ હૈ (યા'ની ઉસ કી હાલત ઐસી હો કે જો દુઅા કરે વોહ કબૂલ હો) વોહ આરમાન કી તરફ હાથ (ઉઠા કર યા રબ ! યા રબ ! કહતા હૈ (દુઅા કરતા હૈ) માંગર હાલત યેહ હો કે ઉસ કા ખાના હરામ, પીના હરામ, લિબાસ હરામ ઔર ગિંગા હરામ ફિર ઉસ કી દુઅા કયુંકર મકબૂલ હો !¹ (યા'ની અગર કબૂલે દુઅા કી જ્વાહિશ હો તો કસબે હલાલ ઈજ્ઞિયાર કરો) **﴿2﴾** લોગોં પર એક જમાના ઐસા આએગા કે આદમી પરવાહ ભી ન કરેગા કે ઈસ ચીજ કો કહાં સે હાસિલ કર્યા હૈ, હલાલ સે યા હરામ સે² **﴿3﴾** જો બન્દા માલે હરામ હાસિલ કરતા હૈ,

ل مسلم ص ٦٥٥ - ٦٥٦ (١٠١٥) ٢ بخاري ج ٢ ص ٧ حديث ٢٠٩٦

﴿فَرَبَّمَا نَهَىٰ عَنِ الْمُحْسِنِ فَلَمَّا أَتَاهُمْ مَا حَسَنُواٰ إِذَا هُمْ بِهِ يَتَكَبَّرُونَ﴾ (١٢) જિસ કે પાસ મેરા જિક હુવા ઓર ઉસ ને મુજ પર હુરેઠ પાક ન પછાતહીક
વોહ બદ બાન્ધ હો ગયા. (નિઃ)

અગર ઉસ કો સ-દકા કરે તો મકબૂલ નહીં ઔર ખર્ચ કરે તો ઉસ કે લિયે ઉસ મેં
બ-ર-કત નહીં ઔર અપને બા'દ છોડ મરે તો જહનામ કો જાને કા સામાન હૈ.
અલ્લાહ તથાલા બુરાઈ સે બુરાઈ કો નહીં ભિટાતા, હાં નેકી સે બુરાઈ કો ભિટાતા
હૈ, બેશક બખીસ (યા'ની નાપાક) કો બખીસ નહીં ભિટાતા¹ ॥૪॥ જિસ ને ઐબ
વાલી ચીજ બેઅ કી (યા'ની બેચી) ઔર ઉસ (ઐબ) કો આહિર ન કિયા, વોહ
હમેશા અલ્લાહ તથાલા કી નારાજી મેં હૈ યા ફરમાયા કે હમેશા ફિરિશે ઉસ
પર લા'નત કરતે હોય.²

લુકમાં હરામ કી નુહૂસત

મુકા-શ-ઇતુલ કુલૂબ મેં હૈ : આદમી કે પેટ મેં જબ લુકમાં હરામ
પડા તો જમીન વ આરમાન કા હર ફિરિશ્તા ઉસ પર લા'નત કરેગા જબ
તક (ઉસ કે પેટ મેં રહેગા ઔર અગર ઈસી હાલત મેં (યા'ની પેટ મેં હરામ
લુકમે કી મૌજૂ-દગ્ги મેં) મૌત આ ગઈ તો દાખિલે જહનામ હોગા.

(مڪاشَفَةُ القُلُوبِ ص ١٠)

હલાલ તરીકે સે કમાને કે 50 મ-દની ફૂલ

«(1) સેઠ ઔર નોકર દોનોં કે લિયે હસ્બે ઝરૂરત ઈજારે કે શર-ઈ
અહકામ સીખના ફર્જ હૈ, નહીં સીખેંગે તો ગુનહગાર હોંગે.
(દા'વતે ઈસ્લામી કે ઈશાઅતી ઈદારે મક-ત-બતુલ મદીના કી મતબૂઅા
બહારે શરીઅત જિલ્દ 3 હિસ્સા 14 સફા 104 તા 184 મેં ઈજારે કે
તફસીલી અહકામ દર્જ હૈનું)

«(2) નોકર રખતે વકત, મુલા-ઝમત કી મુદ્દત, ડ્યૂટી કે અવકાત
લિયાને

٣٤ حدیث ٢ ج ٢ ص ٣٤ مسنداً مام احمد بن حنبل

2 : ٦١٠, ٦١١, ٦٧٢، ابن ماجہ ج ٣ ص ٥٩ حدیث ٦٧٢

ફરમાને મુસ્તકા : ﷺ : જિસ ને મુજ પર દસ મરતબા સુખ ઔર દસ મરતબા શામ હુરુટે પાક પઢા
ઉચ્ચે ડિયામત કે હિન સેરી શફાઅત મિલેગી. (પ્રાર્થના)

ઔર તન-ખ્વાહ વગૈરા કા પહોલે સે તઅથ્યુન હોના જરૂરી હૈ.

(3) મેરે આકા આ'લા હજરત ઈમામ અહ્મદ રજા ખાન ઉલ્લેખારું હુંમણ ફરમાતે હૈનું : કામ કી તીન હાલતેં હૈનું (1) સુસ્ત (2) મો'તદિલ (યા'ની દરમિયાના ઔર) (3) નિહાયત તેજ. અગર મજદૂરી મેં (કમ અંજ કમ મો'તદિલ ભી નહીં મહૂઝ) સુસ્તી કે સાથ કામ કરતા હૈ ગુનહગાર હૈ ઔર ઈસ પર પૂરી મજદૂરી લેની હરામ. ઉતને કામ (યા'ની જિતના ઈસ ને કિયા હૈ) કે લાઈક (મુતાબિક) જિતની ઉજરત હૈ લે, ઈસ સે જો કુછ જિયાદા ભિલા મુસ્તાજિર (યા'ની જિસ કે સાથ મુલા-જમત કા મુઆ-હદા કિયા હૈ ઉસ) કો વાપસ હે.

(ફિતાવા ૨-જવિયા, જિ. 19, સ. 407)

(4) કભી કામ મેં સુસ્ત પડ ગયા તો ગૌર કરે કે “મો'તદિલ” યા'ની દરમિયાના અન્દાજ મેં કિતના કામ કિયા જા સકતા હૈ મ-સલન કમ્પ્યુટર ઓપરેટર હૈ ઔર રોજ કી 100 રૂપિયા ઉજરત ભિલતી હૈ, દરમિયાના અન્દાજ મેં કામ કરને મેં રોજાના 100 સતરેં કમ્પોઝ કર લેતા હૈ મગાર આજ મહૂઝ સુસ્તી યા ગૌર જરૂરી બાતેં કરને કે બાઈસ 90 સતરેં તથાર હુર્દી તો 10 સતરોં કી કમી કે 10 રૂપૈ કટોતી કરવા લે કે યેહ 10 રૂપૈ લેના હરામ હૈ, અગર કટોતી ન કરવાઈ તો ગુનહગાર ઔર નારે જહન્નમ કા હક્કાર હૈ.

(5) ચાહે ગવર્નમેન્ટ કા ઈદારા હો યા પ્રાઇવેટ મુલાજિમ અગર જ્યુટી પર આને કે મુઆ-મલે મેં ઉર્ફ સે હટ કર કસ્ટન તાખીર કરેગા યા જલ્દી ચલા જાએગા યા છુંછિયાં કરેગા તો ઉસ ને મુઆ-હદે કી કસ્ટન ભિલાઝ વર્જી કા ગુનાહ તો કિયા હી કિયા ઔર ઈન સૂરતોં

ફરમાને મુસ્તફા : ﷺ : જિસ કે પાસ મેરા જિક હુંવા ઓર ઉસ ને મુજ પર હૃદય શરીર ન પઢા ઉસ ને જફા કી. (عَلَيْهِ رَحْمَةُ الرَّحْمَنِ)

મેં પૂરી તન-ખ્વાહ લેગા તો મજીદ ગુનહગાર ઓર અજાબે નાર કા હકદાર હોગા. ફરમાને ઈમામ અહમદ રજા ખાન ગઈ : “જો જાઈજ પાબન્દિયાં મશ્રૂત (યા'ની તે કી થીએ) થીં ઉન કા ખિલાફ હરામ હે ઓર બિકે હુએ વક્ત મેં અપના કામ કરના ભી હરામ હે ઓર નાકિસ કામ કર કે પૂરી તન-ખ્વાહ લેના ભી હરામ હૈ.” (ફિતાવા ૨-જવિયા, જિ. 19, સ. 521)

«6» ગવર્નર્મેન્ટ કે ઈદારે કા અફ્સર દેર સે આતા હો ઓર ઉસ કી કોતાહી કે સબબ દફ્તર દેર સે ખુલતા હો તથ ભી હર મુલાઝિમ પર લાઝિમ હે કે તે શુદ્ધ વક્ત પર પહોંચ જાએ અગર્યે બાહર બૈઠ કર ઈન્ટિઝાર કરના પડે. ખાઈન વ ગૈરે મુખ્તાર અફ્સર કા મુલાઝિમ કો દેર સે આને યા જલ્દી ચલે જાને કા કહના યા ઈજાત દે દેના ભી ના જાઈજ કો જાઈજ નહીં કર સકતા. વક્ત કી પાબન્દી સભી પર જરૂરી હી રહેણી.

«7» ગવર્નર્મેન્ટ ઈદારોં મેં અફ્સર ઓર આમ મુલાઝિમ સભી કા મખ્સૂસ વક્ત કા ઈજારા હોતા હે ઓર હર એક કો પૂરી જ્યુટી દેના લાઝિમ હોતા હૈ. બા'જ અવકાત અફ્સર વક્ત સે પહલે ચલા જાતા હે ઓર અપને મા તણૂત મુલાઝિમ સે ભી કહતા હૈ કે તુમ ભી જાઓ ! ચલે જાને વાલા અફ્સર તો ગુનહગાર હોગા લિછાજા વાજિબ હૈ કે કામ હો યા ન હો વહીં દફ્તર મેં ઈજારે કા વક્ત પૂરા કરે. જો ભી ઈસ તરહ ચલા જાએગા ઉસે તન-ખ્વાહ મેં સે કટોતી કરવાની હોણી.

ફરમાને મુસ્તફા : ﷺ : જો મુજ પર રોજ જુમુઆ હુરદ શરીર પઢેગા મેં કિયામત કે દિન ઉસ કી શરીરાંત કરુંગા . (કુબુલ)

અજુર કી ઉજરત કા મરાલા

સુવાખઃ મુલાઝિમ વકત પર પહોંચ ગયા ભગર દફતર કી ચાબી જિસ કે પાસ થી વોહ તાખીર સે આયા યા ગૈર હાલ્કિર રહા ઔર દફતર ન ખુલ સકા, ઐસી સૂરત મેં જો મુલાઝિમ આ ચુકા હૈ ઉસ કી કટોતી હોગી યા પૂરી તન-ખ્વાહ પાએગા ?

જવાખઃ અજુરે ખાસ દો તરણ કે હૈને : મુસ્તકિલ મુલાઝિમ (મ-સલન તન-ખ્વાહ દાર નોકર) ઔર યૌભિયા મુલાઝિમ યા'ની દિહાડી (Daily wages) પર કામ કરને વાલા. દોનોં કો સૂરતે મરાલા (યા'ની પૂછી ગઈ સૂરત) મેં ઉજરત હેને યા ન હેને કા દારો મદાર (ઉર્જ યા સરાહત (યા'ની સાફ અલ્કોઝ મેં તે શુદ્ધ સૂરત) પર હૈ જૈસે ઈજારે કે દીગર બહુત સે મસાઈલ કા દારો મદાર (ઉર્જ યા સરાહત પર હૈ ઔર હમારે યહાં કા ઉર્જ યેહ હૈ કે મુસ્તકિલ મુલાઝિમ કો તો સૂરતે મરાલા મેં ઉજરત દી જાતી હૈ જબ કે દિહાડી (દિલી વેજિઝ, Daily wages) પર કામ કરને વાલે કો નહીં દી જાતી અલબત્તા અગર કિસી જગા કા ઉર્જ ઈસ સે હટ કર હો તો ઉસ કે મુતાબિક અમલ કિયા જાએગા. યુદ્ધી ઉર્જ અગર્યે જો ભી હો લેકિન અગર કિસી કિસ્મ કી સરાહત મૌજૂદ હો તો ફિર ઉસી કા એ'તિબાર હોગા.

(ફિતાવા અહલે સુન્નત ગૈર મત્ભૂઆ)

《8》 મુલાઝિમ દફતર યા દુકાન પર આને જાને કા વકત રજિસ્ટર વગેરા મેં દુરુસ્ત લિખે, અગર ગલત બયાની સે કામ લિયા ઔર જ્યૂટી કમ હેને કે બા વુજૂદ પૂરે વકત કી તન-ખ્વાહ લી તો ગુનહગાર વ અજાબે નાર કા હક્કાર હૈ.

《9》 વકત કે ઈજારે મેં ચાહે કામ હો યા ન હો યા જલ્દી કામ ખત્મ કર

ફરમાને મુસટફા : મુજ પર હુરુદે પાક કી કસરત કરો બેશક યેહ તુમણારે લિયે તહારત હૈ. (તૃતીય)

લેને કી સૂરત મેં અગર વક્ત સે પહલે ચલા ગયા તો માલે વક્ફ સે ઉસે પૂરી તન-ખ્વાહ લેના યા દેના જાઈજ નહીં બલ્કે જિતને ઘન્ટે મ-સલન તીન ઘન્ટે પહલે ચલા ગયા તો ઉસ કદર ઉસ કી ઉજરત મેં સે કમી કી જાએગી. અલભતા નિઝ (યા'ની પ્રાઇવેટ) ઈદારે કા માલિક જાનતે હુએ રિઝા મન્દી કે સાથ પૂરી તન-ખ્વાહ દે દે તો જાઈજ હૈ.

- ﴿10﴾ જિન ઈદારોં મેં બીમારિયોં કી છુણ્ણયાં દી જાતી હું વહાં બીમાર ન હોને કે બા વુજૂદ જૂટ બોલ કર યા ડોક્ટર કી જા'લી (નકલી) ચિંહી દિખા કર છુણ્ણી કરના ગુનાહ હૈ. જાન બૂજ કર જૂટી ચિંહી લિખ કર દેને વાલા ડોક્ટર ભી ગુનહગાર ઔર અજાને નાર કા હક્કાર હૈ.
- ﴿11﴾ જિન ઈદારોં મેં મુલાઝિમીન કો ઈલાજ કી મુફત સહૂલતે ફરાહમ કી જાતી હું, ઈન મેં જૂટે બધાનોં સે દવા હાસિલ કરના, અપના નામ લિખવા યા બતા કર કિસી દૂસરે કે લિયે દવા નિકલવા લેના વગૈરા હરામ ઔર જહન્નમ મેં લે જાને વાલા કામ હૈ. ઐસોં કે સાથ જાન બૂજ કર તાઓવુન કરને વાલા ભી ગુનહગાર હૈ.
- ﴿12﴾ તન-ખ્વાહ જિયાદા કરાને ઔર ઓહદે વગૈરા મેં તરકી કરવાને કે લિયે જા'લી (નકલી) સનદ લેના ના જાઈજ વ ગુનાહ હૈ, ક્યૂંકે યેહ જૂટ ઔર ધોકે પર મબ્ની હૈ.
- ﴿13﴾ મુલાઝિમ કો ચાહિયે દૌરાને જ્યુટી ચાકો ચૌબન્દ રહે, સુસ્તી પૈદા કરને વાલે અરબાબ સે બચે મ-સલન રાત દેર સે સોને કે સબબ બલ્કે નફલી રોજા રખને કે બાઈસ અગર કામ મેં કોતાહી હો જાતી હૈ તો ઈન અફાલ સે બાજ રહે કે કસ્ટન કામ મેં સુસ્તી કરને વાલા

ફરમાને મુસ્તિફા : ﷺ : તુમ જાણ ભી હો મુજ પર હુરદ પથે કે તુમ્હારા હુરદ મુજ તક પહોંચતા હૈ. (બુન.)

અગર્યે કટોતી કરવા દે મગર અબ ભી એક તરછ સે ગુનહગાર હૈ, ક્યુંકે ઈસ ને કામ કરને કા મુઆ-હદા કિયા હુવા હૈ ઔર ઈસ મુઆ-હદે કી રૂ સે કમ અઝ કમ મો'તદિલ યા'ની દરમિયાના અનદાજ મેં ઈસ કો કામ કરના જરૂરી હૈ. અભી “ફતાવા ૨-જવિયા” જિલ્દ 19 સફાહા 407 કે હવાલે સે ગુજરા કે “અગર મજદૂરી મેં સુસ્તી કે સાથ કામ કરતા હૈ ગુનહગાર હૈ.” આહિર હૈ મુલાજિમ કી બે જા સુસ્તિયોં ઔર છુટિયોં સે સેઠ કે કામ કા નુક્સાન હોતા હૈ બહાર હાલ કોઈ પૂછને વાલા હો યા ન હો સુસ્તી કે બાઈસ કામ મેં જિતની કમી હુઈ અલ્લાહ ઉર્રોજલ સે ડરતે હુએ તન-ખ્વાહ મેં ઉતની કટોતી કરવાએ, તૌબા ભી કરે ઔર મુસ્તાજિર (યા'ની જિસ સે ઈજારા કિયા હૈ) ઉસ સે મુઆફી ભી માંગે. હાં નિશ્ચ (Private) ઈદારા હૈ ઔર સેઠ કટોતી કી રકમ ભી મુઆફ કર દે તો એનાં ખલાસી (યા'ની નજાત) હો જાએગી.

﴿14﴾ અજીરે ખાસ (યા'ની જો મખ્સૂસ વક્ત મેં કિસી એક દી સેઠ યા ઈદારે કે કામ કા પાબન્ધ હો) ઉસ મુદતે મુકર્રા મેં (યા'ની દૌરાને જ્યુટી) અપના જાતી કામ ભી નહીં કર સકતા ઔર અવકાતે નમાજ મેં ફર્જ ઔર સુન્તે મુઅક્કદા પઢ સકતા હૈ નફલ નમાજ પઢના ઈસ કે લિયે અવકાતે ઈજારા મેં જાઈજ નહીં (જબ કે સરા-હતન યા ઉફીન ઈજાજત ન હો) ઔર જુમુઆ કે દિન નમાજે જુમુઆ પઢને કે લિયે જાએગા મગર જામેઅ મરિજિદ અગર દૂર હૈ કે વક્ત જિયાદા સર્જ હોગા તો ઉતને વક્ત કી ઉજરત કમ કર દી જાએગી ઔર અગર નજદીક હૈ તો કુદુ કમી નહીં કી જાએગી અપની ઉજરત પૂરી

કરમાને મુસટાફા : ﷺ : જિસ ને મુજ પર દસ મરતબા હુરેટે પાક પડા અલ્લાહ ઉર્જુ ઉસ પર સો રહ્માને નાખિલ કરમાતા હૈ. (بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ)

પાએંગા. (બહારે શરીઅત, જિ. 3, સ. 161, ૧૧૮ ص ૧) (અગર ડ્યુટી કે દૌરાન નમાજે ઈશા આઈ તો વિત્ર પઢ સકતા હૈ)

﴿15﴾ અગર કિસી ઉઝ્ર કી વજહ સે અજ્રે ખાસ કામ ન કર સકા તો ઉજરત કા મુસ્તાફિક નહીં હૈ મ-સલન બારિશ હો રહી થી જિસ કી વજહ સે કામ નહીં કિયા અગર્યે હાજિર હુવા ઉજરત નહીં પાએંગા (યા'ની ઉસ દિન કી તન-ખ્વાહ નહીં મિલેગી). (ઐજન, ૧૧૭ ص ૧) (અલ્લાહ ઉસ દિન કી તન-ખ્વાહ કા ભી ઉર્જ હૈ તો મિલેગી કે તા'તીલાતે મા'છૂદા (યા'ની જિન છુટ્ટિયોં કા મા'મૂલ હોતા હૈ ઉન) કી તન-ખ્વાહ મિલતી હૈ.

﴿16﴾ હર મુલાજિમ અપને રોજાના કે કામ કા એહતિસાબ (યા'ની હિસાબ કિતાબ) કરે કે આજ ડ્યુટી કે અવકાત મેં ગૈર ઝરુરી બાતોં યા બે જા કામોં વગેરા મેં કિતના વકત ખર્ચ હુવા ? આને મેં કિતની તાખીર હુઈ ? વગેરા નીજ ગૈર વાજિબી છુટ્ટિયોં કા શુમાર કર કે ખુદ હી હિસાબ લગા કર હર માહ તન-ખ્વાહ મેં કટોતી કરવા લે. દા'વતે ઈસ્લામી કે જામિઆતુલ મદીના ઔર દીગર શો'ઓં મેં બા'જ અજ્ર મોહતાતીન દેખે હોય જો અપને મુશા-હરે (યા'ની તન-ખ્વાહ) મેં સે હર માહ એહતિયાતન કુછ ન કુછ કટોતી કરવા લેતે હોય. ઈન કા જરૂબા સંદ કરોડ મરહબા ! હર એક કો ઈન અશ્લોં કી નકલ કરની ચાહિયે. અપના આતા અગર ઈદારે કે પાસ રહ ગયા તો કોઈ નુકસાન નહીં મગર એક રૂપિયા ભી કસ્ઠન ના જાઈઝ લે લિયા તો આખિરત કે અઝાબ કી તાબ કિસી મેં નહીં.

﴿17﴾ મુરાકિબ (યા'ની સુપર વાઈજર) યા મુકર્રા જિમ્મોદાર તમામ મજદૂરોં કી હસબે ઈસ્તિતાઅત નિગરાની કરે. વકત ઔર કામ મેં કોતાહી ઔર સુસ્તિયાં કરને વાલોં કી મુક્ખમલ

ਫਰਮਾਨੇ ਮੁਸਤਕਾਮ : ﷺ : ਜਿਸ ਕੇ ਪਾਸ ਮੇਰਾ ਛਿਕ ਹੋ ਔਰ ਵੋਡ ਮੁਜ ਪਰ ਫੁਰ੍ਦ ਸ਼ਰੀਫ ਨ ਪਢੇ ਤੋਂ ਵੀਗੋਂ ਮੇਂ ਸੇ ਕਾਜ਼ੂਸ ਤਰੀਨ ਥਾਪਿਆ ਹੈ। (زبان)

ਕਾਰਕਦੰਗੀ (ਰਿਪੋਰਟ) ਕਮਧਨੀ ਯਾ ਈਦਾਰੇ ਕੇ ਮੁ-ਤਅਲਿਕਾ ਅਫਸਰ ਤਕ ਪਹੁੰਚਾਓ। ਮੁਰਾਕਿਬ (ਸੁਪਰ ਵਾਈਜ਼ਰ) ਅਗਰ ਹਮਦੰਦੀ ਯਾ ਮੁਰਵਵਤ ਯਾ ਕਿਸੀ ਭੀ ਸਥਾਨ ਦੇ ਜਾਨ ਬੂਜ ਕਰ ਪਦਾ ਜਾਵੇਗਾ ਤੋ ਖਾਈਨ ਵ ਗੁਨਹਗਾਰ ਔਰ ਅਜਾਬੇ ਨਾਰ ਕਾ ਛਕਦਾਰ ਹੋਗਾ।

《18》 ਮੁੜਾਈ ਯਾ ਸਮਾਜ ਈਦਾਰੇ ਕੇ ਮੁਕਰੰਦ ਜਿਮੇਦਾਰਾਨ ਵ ਮੁਝਤਿਸ਼ੀਨ ਅਗਰ ਈਦਾਰੇ ਕੇ ਮੁਲਾਕਿਮੀਨ ਕੀ ਕੋਤਾਹਿਯੋਂ ਔਰ ਗੈਰ ਕਾਨੂੰਨੀ ਛੁਹਿਯੋਂ ਦੇ ਵਾਕਿਫ ਹੋਨੇ ਕੇ ਬਾ ਵੁਜ਼ਦ ਆਂਖ ਆਡੇ ਕਾਨ ਕਰੇਂ (ਧਾ'ਨੀ ਜਾਨ ਬੂਜ ਕਰ ਅਨਜ਼ਾਨ ਬਨੇਂ) ਗੇ ਔਰ ਈਸ ਵਜ਼ਹ ਦੇ ਉਨ ਮੁਲਾਕਿਮੀਨ ਕੀ ਵਕਫ ਕੀ ਰਕਮ ਦੇ ਮੁਕਭਮਲ ਤਨ-ਘਾਹ ਦੀ ਜਾਅੰਦੀ ਤੋ ਲੇਨੇ ਵਾਲੋਂ ਕੇ ਸਾਥ ਸਾਥ ਮੁ-ਤਅਲਿਕਾ ਜਿਮੇਦਾਰ ਭੀ ਖਾਈਨ ਵ ਗੁਨਹਗਾਰ ਔਰ ਅਜਾਬੇ ਨਾਰ ਕੇ ਛਕਦਾਰ ਹੋਂਗੇ।

《19》 ਕਿਸੀ ਮੁੜਾਈ ਈਦਾਰੇ ਮੈਂ ਈਜਾਰੇ ਕੇ ਸ਼ਰ-ਈ ਮਸਾਈਲ ਪਰ ਸਖ਼ਤੀ ਦੇ ਅਮਲ ਫੇਖ ਕਰ ਨੋਕਰੀ ਦੇ ਕਤਰਾਨਾ ਯਾ ਸਿੱਖ ਈਸ ਵਜ਼ਹ ਦੇ ਮੁਸਤਾਫੀ ਹੋ ਕਰ ਐਸੀ ਜਗਾਹ ਮੁਲਾ-ਗਮਤ ਈਖਿਤਿਆਰ ਕਰ ਲੇਨਾ ਜਹਾਂ ਕੋਈ ਪ੍ਰਭਿਨੇ ਵਾਲਾ ਨ ਹੋ ਈਖਿਤਿਖਾਈ ਨਾ ਮੁਨਾਸਿਬ ਹੈ। ਜੇਹੜਨ ਧੇਹ ਬਨਾਨਾ ਚਾਹਿਏ ਕੇ ਜਹਾਂ ਈਜਾਰੇ ਕੇ ਸ਼ਰ-ਈ ਅਹਕਾਮ ਪਰ ਸਖ਼ਤੀ ਦੇ ਅਮਲ ਹੋ ਵਹਿੰਦੀ ਕਾਮ ਕਰੁੰ ਤਾਕੇ ਈਸ ਕੀ ਬ-2-ਕਤ ਦੇ ਮਾਂਸਿਧਤ ਕੀ ਨੁਹੂਸਤ ਦੇ ਬਚ੍ਚੂ ਔਰ ਹਲਾਲ ਔਰ ਸੁਥਰੀ ਰੋਜ਼ੀ ਭੀ ਕਮਾ ਸਕੂ।

《20》 ਜੋ ਈਜਾਰੇ ਕੇ ਮੁਤਾਬਿਕ ਕਾਮ ਨਹੀਂ ਕਰ ਪਾਤਾ ਮ-ਸਲਨ ਮੁਦਰਿਸ ਹੈ ਮਹਾਰ ਸਹੀਲ ਪਥਾ ਨਹੀਂ ਪਾ ਰਹਾ ਤੋ ਉਸੇ ਚਾਹਿਏ ਕੇ ਫੌਰਨ ਮੁਸਤਾਜ਼ਿਰ (ਧਾ'ਨੀ ਜਿਸ ਦੇ ਈਜਾਰਾ ਕਿਯਾ ਹੈ ਉਸ) ਕੀ ਮੁਤਲਅ ਕਰੇ।

ਫਰਮਾਨੇ ਮੁਸਤਕਾ ﷺ : ਉਸ ਸ਼ਾਬਿਦੀ ਕੀ ਨਾਕ ਖਾਕ ਆਵੂਦ ਹੋ ਜਿਸ ਕ ਪਾਸ ਮੇਰਾ ਜਿਕ ਹੋ ਓਰ ਵੀਡ
ਮੁੜ ਪਰ ਫੁਰੇਟ ਪਾਕ ਨ ਪਢੇ। (੬)

﴿21﴾ ਅਗਰ ਵਕਫ਼ ਕੇ ਈਦਾਰੇ ਕਾ ਕੋਈ ਮੁਦਰਿੰਸ ਫੁਰਸਤ ਨਹੀਂ ਪਥਾ ਪਾ ਰਹਾ
ਈਸੀ ਤਰਛ ਨਾਜਿਮ ਯਾ ਕਿਸੀ ਤਰਛ ਕਾ ਅਛਾਰ ਉੱਵ ਆਏਤ ਸੇ ਛਟ
ਕਰ ਕੋਤਾਹਿਯਾਂ ਕਰ ਰਹਾ ਹੈ ਤੋ ਮੁ-ਤਅਲਿਕਾ ਜਿਮੇਦਾਰ ਪਰ ਵਾਜਿਬ
ਹੈ ਕੇ ਉਸ ਕੋ ਮਾ'ਜੂਲ ਕਰ ਦੇ।

﴿22﴾ ਅਗਰ ਮਖੂਸ ਮੁਦਤ ਮ-ਸਲਨ ਬਾਰਛ ਮਾਣ ਕੇ ਲਿਖੇ ਮੁਲਾ-ਜਮਤ ਕਾ
ਈਆਰਾ ਹੋ ਤੋ ਅਥ ਫਰੀਡੈਨ ਕੀ ਰਿਆ ਮਨ੍ਹੀ ਕੇ ਬਿਗੈਰ ਈਆਰਾ ਖਤਮ
ਨਹੀਂ ਹੋ ਸਕਤਾ, ਸੇਠ ਕਾ ਘਵਾਹ ਮ ਘਵਾਹ ਧਾਂਖਿਆਂ ਫੇਨਾ ਕੇ (ਵਕਤ ਸੇ
ਪਛਲੇ ਹੀ) ਝਾਰਿਗ ਕਰ ਫੁੰਗਾ ਨੀਜ ਈਸੀ ਤਰਛ ਊਜਰਤ ਮਨ੍ਹ ਸੇਠ ਕੋ
ਨੋਕਰ ਕਾ ਤਾਤੇ ਰਹਨਾ ਕੇ ਨੋਕਰੀ ਛੋਡ ਕਰ ਚਲਾ ਜਾਓਂਗਾ, ਫੁਰਸਤ
ਨਹੀਂ। ਹਾਂ ਜਿਨ ਮਜ਼ਬੂਰਿਆਂ ਕੀ ਸ਼ਾਰੀਅਤ ਤਸਲੀਮ ਕਰਤੀ ਹੈ ਈਸ ਸੂਰਤ
ਮੌਫ਼ਨਾਂ ਮੌਫ਼ਨਾਂ ਦੇ ਕੋਈ ਭੀ ਵਕਤ ਸੇ ਪਛਲੇ ਈਆਰਾ ਖਤਮ ਕਰ ਸਕਤਾ ਹੈ।

﴿23﴾ ਅਗਰ ਕਿਸੀ ਸੇ ਕਿਛੁ ਫਿਦਾ ਕੇ ਪਛਲੀ ਤਾਰੀਖ ਸੇ ਨੋਕਰੀ ਯਾ ਕਾਮ ਪਰ
ਆ ਜਾਨਾ ਔਰ ਊਜਰਤ ਤੈਂ ਕਰ ਲੀ ਮਹਾਰ ਮੁਦਤ ਤੈਂ ਨਹੀਂ ਕੀ ਤੋ ਉੱਝ
ਫੇਖਾ ਜਾਵੇਗਾ ਅਗਰ ਫਿਛਾਈ ਪਰ ਰਖਤੇ ਹੋਂ ਤੋ ਏਕ ਦਿਨ ਕਾ, ਛੱਫ਼ਤੇ
ਕੇ ਲਿਖੇ ਰਖਤੇ ਹੋਂ ਤੋ ਏਕ ਛੱਫ਼ਤੇ ਕਾ ਔਰ ਅਗਰ ਮਹੀਨੇ ਕੇ ਲਿਖੇ
ਰਖਤੇ ਹੋਂ ਤੋ ਏਕ ਮਹੀਨੇ ਕਾ ਅਛਾਰ ਕਰਾਰ ਪਾਵੇਗਾ। ਮ-ਸਲਨ
ਉਸ ਕਾਮਕਾਜ਼ ਮੌਫ਼ਨਾਂ ਏਕ ਮਹੀਨੇ ਕਾ ਉੱਝ (ਧਾ'ਨੀ ਮਾ'ਜੂਲ) ਹੋ ਤੋ
ਸੇਠ ਔਰ ਨੋਕਰ ਫੋਨਾਂ ਕੀ ਈਜ਼ਿਤਧਾਰ ਹੈ ਕੇ ਮਹੀਨਾ ਪੂਰਾ ਹੋ
ਜਾਨੇ ਪਰ ਈਆਰਾ ਖਤਮ ਕਰ ਦੇਂ, ਅਗਰ ਈਆਰਾ ਖਤਮ ਨ ਕਿਧਾ
ਔਰ ਫੂਸਰੇ ਮਹੀਨੇ ਕੀ ਏਕ ਰਾਤ ਔਰ ਏਕ ਦਿਨ ਗੁਜਰ ਗਿਆ ਤੋ
ਅਥ ਯੇਹ ਮਹੀਨਾ ਪੂਰਾ ਹੋਨੇ ਦੇ ਕਿਲ੍ਹ ਈਆਰਾ ਖਤਮ ਕਰਨੇ ਕੀ
ਈਆਜ਼ਤ ਨਹੀਂ, ਜਥੁ ਭੀ ਈਆਰਾ ਖਤਮ ਕਰਨਾ ਹੋ ਮਹੀਨੇ ਕੇ ਪਛਲੇ ਦਿਨ

ਫਰਮਾਨੇ ਮੁਸਤਕਾ: ਇਸਦੀ ਅਤਾਲ ਉਲੰਹ ਅਤੇ ਵਾਰ ਹੁਕਾਮ ਪਾਕ ਪਦਾ ਉਚ ਕੇ ਦੀ ਸਾਂ ਸਾਲ
ਤੇ ਗੁਣਾਤ ਮੁਆਕ ਹੋਂਗੇ। (ਕਰਮਾਨ)

ਹੀ ਖਤਮ ਕਰਨਾ ਹੋਗਾ, ਹਾਂ ਮਹੀਨਾ ਪੂਰਾ ਹੋਨੇ ਦੇ ਕਬਲ ਅਤੇ ਵ
ਮੁਸ਼ਟਾਇਰ ਏਕ ਦੂਜੇ ਕੋ ਮੁਜਲਅ ਕਰ ਸਕਤੇ ਹੋਣੇ ਦੇ ਆਨੇ ਵਾਲੇ
ਮਾਛ ਕੀ ਪਹਲੀ ਤਾਰੀਖ ਦੇ ਇਆਰਾ ਖਤਮ ਹੋ ਜਾਵੇਗਾ। ਫਿਤਾਵਾ
੨-ਅਵਿਧਾ ਜਿਲ੍ਹ 16 ਸਫ਼਼ਾ 346 ਪਰ ਏਕ ਸੁਵਾਲ ਦੇ ਜਵਾਬ ਮੌਲਿਕ
ਲਿਖਾ ਹੈ : ਆਮ ਰਵਾਇ ਯੇਹੀ ਹੈ ਕੇ ਕੋਈ ਮੁਦਤੇ ਇਆਰਾ ਮੁਅਧਨ
(ਯਾਂਨੀ fix) ਨਹੀਂ ਕੀ ਜਾਂਦੀ ਕੇ (ਮ-ਸਲਨ) ਸਾਲ ਭਰ ਦੇ ਲਿਧੇ ਤੁੱਝੇ
ਇਮਾਮ ਕਿਧਾ ਯਾਹੁ ਮਹੀਨੇ ਦੇ ਲਿਧੇ ਬਲਕੇ ਸਿੱਫ਼ ਇਮਾਮਤ ਔਰਾ
ਇਸ ਦੇ ਮੁਕਾਬਿਲ ਮਾਛਵਾਰ ਇਤਨਾ (ਮੁਸ਼ਾ-ਹਰਾ, ਤਨ-ਘਵਾਹ ਤੋਂ)
ਪਾਨੇ ਕਾ ਬਧਾਨ ਹੋਤਾ ਹੈ, ਤੋਂ (ਇਸ ਤਰਹ ਕਾ) ਇਆਰਾ ਸਿੱਫ਼ ਪਹਲੇ
ਮਹੀਨੇ ਦੇ ਲਿਧੇ ਸਹੀਉ ਹੁਵਾ ਔਰਾ ਹਰ ਸਿਰੇ ਮਾਛ (ਯਾਂਨੀ ਹਰ
ਮਹੀਨੇ ਕੀ ਇਹਨਿਦਾ ਹੋਤੇ ਹੋਣੇ) ਅਤੇ ਵ ਮੁਸ਼ਟਾਇਰ ਹਰ ਏਕ ਕੋ
ਦੂਜੇ ਦੇ ਸਾਮਨੇ ਇਸ ਦੇ ਫਲਾਅ (ਯਾਂਨੀ ਮਨੁੱਖ) ਕਰ ਦੇਨੇ ਕਾ ਇਹਨਿਧਾਰ
ਹੋਤਾ ਹੈ। “ਹੁਰੋ ਮੁਖਤਾਰ” ਮੌਲਿਕ ਦੇ ਪਰ ਦੀ,
ਕੇ ਹਰ ਮਾਛ ਇਤਨਾ ਕਿਰਾਚਾ ਹੋਗਾ ਤੋਂ ਫਿਕਤ ਏਕ ਮਾਛ ਦੇ ਲਿਧੇ
ਇਆਰਾ ਸਹੀਉ ਹੁਵਾ, ਬਾਕੀ ਮਹੀਨਿਆਂ ਮੌਲਿਕ ਸਾਬਦੇ ਜਹਾਲਤ ਦੇ
(ਯਾਂਨੀ ਮੁਦਤ ਕਾ ਤਅਧੂਨ ਵਾਡੇ ਨ ਹੋਨੇ ਕੀ ਵਜ਼ਹ ਦੇ ਇਆਰਾ) ਫਾਲਿਦ
ਹੈ ਔਰਾ ਜਬ ਮਹੀਨਾ ਪੂਰਾ ਹੋ ਗਿਆ ਤੋਂ ਫਿਲਿਆਂ ਮੌਲਿਕ ਏਕ ਕੋ
ਦੂਜੇ ਕੀ ਮੌਜੂ-ਦਗੀ ਮੌਲਿਕ ਇਆਰਾ ਫਲਾਅ (ਯਾਂਨੀ ਮਨੁੱਖ) ਕਰਨੇ ਕਾ
ਇਹਨਿਧਾਰ ਹੈ ਕਿਧੂਂ ਕੇ ਅਕਦੇ ਸਹੀਉ ਖਤਮ ਹੋ ਗਿਆ।

﴿24﴾ ਮੁਸਲਿਮਾਨ ਨੇ ਕਾਫ਼ੀ ਕੀ ਖਿਦਮਤ ਗਾਰੀ ਕੀ ਨੋਕਰੀ ਕੀ, ਧੇਹ ਮਨੁੱਖ

૬૨માને મુસ્તકા : મુજ પર હુરદ શરીર પઢો અલ્લાહ રૂતુમ પર રહમત ભેજોગા। (ابن عુરૈ)

હે બલ્કે કિસી ઐસે કામ પર કાફિર સે ઈજારા ન કરે જિસ મેં મુસ્લિમ કી જિલ્લત હો (કે ઐસા ઈજારા જાઈજ નહીં)। (૧૯૮૬૭ હિન્દી) (ઉમ્રૂમી તૌર પર યેહ કામ યા'ની કાફિર કે પાઉ દબાના, ઉસ કે બચ્ચોં કી ગંદગિયાં ઉઠાના, ઘર યા દફૃતર કા ઝડૂ પોચા કરના, ગંદ કચરા ઉઠાના, લેટ્રીન ઓર ગંદી નાલિયોં કી સફાઈ, ઉસ કી ગાડી કી ધુલાઈ કરના વગેરા જિલ્લત મેં શામિલ હે. અલબત્તા ઐસી નોકરી જિસ મેં મુસ્લિમાન કી જિલ્લત ન હો વોહ કાફિર કે યહાં જાઈજ હૈ.

﴿25﴾ સાથ્યદ ઝાંદે કો ભી જિલ્લત કે કામોં પર મુલાજિમ રખના જાઈજ નહીં. દા'વતે ઈસ્લામી કે ઈશાઅતી ઈદારે મક-ત-બતુલ મદીના કી મલ્બૂઆ 692 સફાત પર મુશ્તમિલ કિતાબ, “કુફ્લિયા કલિમાત કે બારે મેં સુવાલ જવાબ” સફાત 284 તા 285 પર હૈ : મેરે આકા આ'લા હજરત, ઈમામે અહલે સુન્નત, મૌલાના શાહ ઈમામ અહમદ રજા ખાન કી ઉલ્લીલી રહ્મતી રહ્મન મિદમત મેં સુવાલ હુવા : સાથ્યદ કે લડકે સે જબ શાગિર્દ હો યા મુલાજિમ હો દીની યા દુન્યવી મિદમત લેના ઓર ઉસ કો મારના જાઈજ હૈ યા નહીં ? અલ જવાબ : જલીલ મિદમત ઉસ સે લેના જાઈજ નહીં, ન ઐસી મિદમત પર ઉસે મુલાજિમ રખના જાઈજ. ઓર જિસ મિદમત મેં જિલ્લત નહીં ઉસ પર મુલાજિમ રખ સકતા હૈ, બહાલે શાગિર્દ ભી જહાં તક ઉફ ઓર મા'રૂફ હો (મિદમત લેના) શરઅન જાઈજ હૈ, લે સકતા હૈ ઓર ઉસે (યા'ની સાથ્યદ કો) મારને સે મુત્લક એહતિરાજ (યા'ની બિલ્કુલ પરહેજ) કરે. وَاللَّهُ تَعَالَى أَعْلَم.

ફરમાને મુસ્તકા, ﷺ : મુઝ પર કસરત સે હુરેટ પાક પઢો બેશક તુખારા મુઝ પર હુરેટ પાક પઢના
તુમણારે ગુનાંડો કે લિયે માણિકરત હૈ. (અભૂત)

(ફત્વા ર-જવિયા, જિ. 22, સ. 568)

﴿26﴾ મુલાજિમ અપને દફતર વગેરા કા કલમ, કાગળ ઔર દીગર અશ્યા અપને જાતી કામોં મેં સર્જ કરને સે ઈજતિનાબ (યા'ની પરહેજ) કરે.

﴿27﴾ અગર ઈજારે કી તરફ સે જાતી કામ મેં ટેલીફોન ઈસ્ટિ'માલ કરને કી ઈજાયત હો તો ઈજાયત કી હદ તક ઈસ્ટિ'માલ કર સકતે હોય અગર ઈજાયત નહીં તો જાતી કામ કે લિયે ઈસ્ટિ'માલ કરના ના જાઈજ વ ગુનાંડ હૈ.

﴿28﴾ ઈજારે કે વકત મેં કબ્બી કભાર બહુત કલીલ (યા'ની થોડે સે) વકત કે લિયે જાતી ફોન સુનને કી ઉર્ફન ઈજાયત હોતી હૈ. અલબત્તા અગર કોઈ ઈજારે કે અવકાત મેં બાર બાર ફોન સુનતા હૈ ઔર ફિર બાતચીત ભી દસ પન્દરહ મિનાટ સે કમ નહીં હોતી ઈસ તરફ કે જાતી ફોન સુનના જાઈજ નહીં કે ઈસ તરફ કામ ઔર મુસ્તાજિર (યા'ની ઈજારે પર લેને વાલે) કા ભી નુકસાન હોગા.

﴿29﴾ મુલાજિમ કો ઈજારે કી મુદ્દત કે દૌરાન બાત બાત પર ધમકી દેના કે મુદ્દત પૂરી હોને સે પહુંલે હી નોકરી સે નિકાલ દુંગા હુરુસ્ત નહીં બલ્કે બા'જ અવકાત કિસી છોટી સી બાત પર ગુસ્સા આ જાને પર નિકાલ ભી દેતે હોય એસા કરના જાઈજ નહીં, હાં કોઈ બહુત બડા મુઆ-મલા દરપેશ હુવા જો શરઅન યક-તરફા ઈજાયત સે ફસ્ખ કરને કા ઉજ્જર હો તો દોનોં મેં સે કોઈ ભી ઈજારા ખત્મ કર સકતા હૈ મ-સલન દૂસરે મુલ્ક મેં ગયા ઔર દો² સાલ કા ઈજારા તૈ

کرمان مسکن کا۔ جو بھی اللہ تعالیٰ علیہ و السلام اور حضرت پیر حیدر شاہ ریگ پختا ہے اور عزوجل عزیز اس کے لیے اک دیڑھ آج لیبھا کے اور دیڑھ پکھاں جتنا ہے۔ (مہاجر ایڈن)

હુવા મગર એક સાલ પૂરા હોતે હી Visa કી મુદ્દત ખત્મ હો ગઈ ઔર
મજીદ ન ભિલા તો મુલાજિમ ઈજારા ખત્મ કર દે ક્ર્યુંકે કાનૂની
જુર્મ હોને કી વજહ સે બિગેર Visa ઉસે વહાં રહેના જાઈએ નહીં.

- 『30』 અગર નોકરી (યા કિરાએ પર લી હુઈ દુકાન વગેરા) છોડના હો તો એક માહ પહલે બતાના હોગા વરના એક મહીને કી તન-ખ્વાહ કાટી જાએગી (યા કિરાયા વુસૂલ કિયા જાએગા), મુલાજિમ (યા કિરાયા દાર) સે ઈસ તરણ કા કિયા હુવા મુઆ-હદા બાતિલ હૈ. અગર ઉસ ને એક માહ પહલે બતાએ બિગેર નોકરી ખત્મ કર દી (યા કિરાએ પર લી હુઈ જગા ખાલી કર દી) તથ ભી તન-ખ્વાહ કાટના (યા ઝાઈદ કિરાયા વુસૂલ કરના) જુલ્ભ હોગા, ઐસે મૌકાએ પર એક મહીના તો કિયા એક ઘન્ટે કી ભી તન-ખ્વાહ કાટી (યા ઝાઈદ કિરાયા વુસૂલ કિયા) તો ગુનહગાર ઔર અજાબે નાર કા હક્કદાર હોગા.

『31』 મુલાજિમ ને અગર મરજ કી વજહ સે છુટ્ટી કર લી યા કામ કમ કિયા તો મુસ્તાજિર (યા'ની જિસ સે ઈજારા કિયા હૈ ઉસ) કો તન-ખ્વાહ મેં સે કટોતી કરને કા હક હાસિલ હૈ. મગર ઈસ કી સૂરત યેહ હૈ કે જિતના કામ કમ કિયા સિર્ફ ઉતની હી કટોતી કી જાએ મ-સલન 8 ઘન્ટે કી ઝ્યૂટી થી ઔર તીન ઘન્ટે કામ ન કિયા તો સિર્ફ તીન ઘન્ટે કી ઉજરત કાટી જાએ, પૂરે દિન બલ્કે આધે દિન કી ઉજરત કાટ લેના ભી જુલ્ભ હૈ. (તફસીલ કે લિયે ફતાવા 2-જવિયા જિલ્દ 19 સફહા 515 તા 516 દેખ લીજિયે)

『32』 ઈમામ વ મઅજિઝન ઉર્ફ વ આદત કી છુટ્ટીઓં કે ઈલાવા

ਫਰਮਾਨੇ ਮੁਸਤਕਾਮ : ﷺ : ਜਿਸ ਨੇ ਉਤਾਬ ਮੈਂ ਮੁਝ ਪਰ ਫੁਰ੍ਦੇ ਪਾਕ ਲਿਆ ਤੋ ਜਥੁਂ ਤਕ ਮੇਰਾ ਨਾਮ ਉਸ ਮੈਂ ਰਖੇਗਾ ਫਿਰਿਸ਼ਤੇ ਉਸ ਕੇ ਲਿਧੇ ਈਸ਼ਟਿਆਕ ਕਰਤੇ ਰਹੇਗੇ। (ਬਾਬ)

ਅਗਰ ਗੈਰ ਹਾਜ਼ਿਰੀ ਕਰੇਂ ਤੋ ਤਨ-ਘਵਾਹ ਮੈਂ ਕਟੋਤੀ ਕਰਵਾ ਲਿਆ ਕਰੇਂ। ਮ-ਸਲਨ ਈਮਾਮ ਕੀ ਤੀਨ ਹਜ਼ਾਰ ਰੂਪੈ ਮਾਹਾਨਾ ਤਨ-ਘਵਾਹ ਹੈ ਤੋ ਛੁਹਿਧਾਂ ਕਰਨੇ ਪਰ ਝੀ ਨਮਾਯ 20 ਰੂਪੈ ਕਟਵਾ ਲੋਂ, ਈਸੀ ਤਰਫ ਮੁਅਝਿੰਨ ਸਾਡਿਬ ਭੀ ਛਿਸਾਬ ਲਗਾ ਲੋਂ। (ਬਿਲਾ ਊਝ੍ਰੇ ਸਹੀਹ ਕਸ਼ਣ ਮੁਆ-ਹਦੇ ਕੀ ਬਿਲਾਫ਼ ਵਰੀ ਕੀ ਔਰ ਛੁਹਿਧਾਂ ਕਰਤਾ ਰਹਾ ਤੋ ਕਟੋਤਿਆਂ ਕਰਵਾਨੇ ਕੇ ਬਾ ਵੁਜੂਦ ਗੁਨਾਹ ਜਿਸੇ ਬਾਕੀ ਰਹੇਂਗੇ, ਲਿਹਾਜਾ ਸਚੀ ਤੌਬਾ ਕਰੇ ਔਰ ਈਸ ਤਰਫ ਕੀ ਮਨ ਮਾਨੀ ਛੁਹਿਧਾਂ ਸੇ ਬਾਝ ਰਹੇ)

《33》 ਈਮਾਮ ਵ ਮੁਅਝਿੰਨ, ਖਾਇਮੇ ਮਖ਼ਿਛਦ ਔਰ (ਦੀਨੀ ਵ ਹੁਨ੍ਯਵੀ) ਹਰ ਤਰਫ ਕੀ ਮੁਲਾ-ਜ-ਮਤਾਂ ਮੈਂ ਉੱਝ ਵ ਆਦਤ (ਧਾ'ਨੀ ਜਾਰੀ ਮਾ'ਮੂਲ) ਕੇ ਮੁਤਾਬਿਕ ਕੀ ਜਾਨੇ ਵਾਲੀ ਛੁਹਿਧਾਂ ਮੈਂ ਤਨ-ਘਵਾਹ ਕੀ ਕਟੋਤੀ ਨਹੀਂ ਕੀ ਜਾ ਸਕਤੀ, ਅਲਭਤਾ ਉੱਝ (ਰਾਈਜ ਤਰੀਕੇ) ਸੇ ਹਟ ਕਰ ਜੋ ਛੁਹਿਧਾਂ ਕੀ ਜਾਂਦੇ ਉਨ ਪਰ ਤਨ-ਘਵਾਹ ਕਾਟੀ ਜਾਂਦੇ।

《34》 ਜੋ ਅਪਨੇ ਪਲ੍ਵੇ ਸੇ ਤਨ-ਘਵਾਹ ਦੇਤਾ ਹੋ ਉਸੇ ਈਮਾਮ ਧਾ ਮੁਅਝਿੰਨ ਵਗੈਰਾ ਕੇ ਉੱਝ ਸੇ ਜਾਈਦ ਛੁਹਿਧਾਂ ਕਰਨੇ ਪਰ ਕਟੋਤੀ ਕਰਨੇ ਨ ਕਰਨੇ ਕਾ ਈਖਿਤਧਾਰ ਹੈ। ਈਸੀ ਤਰਫ ਸੇਠ ਅਪਨੇ ਨੋਕਰ ਕੇ ਮੁਆ-ਮਲੇ ਮੈਂ ਬਾ ਈਖਿਤਧਾਰ ਹੈ।

《35》 ਹਮਾਰੇ ਉੱਝ ਮੈਂ ਈਮਾਮ ਵ ਮੁਅਝਿੰਨ ਕੋ ਮਹੀਨੇ ਮੈਂ ਏਕ ਧਾ ਛੁਹਿਧਾਂ ਕਰਨੇ ਕੀ ਈਖ਼ਾਜ਼ਤ ਹੋਤੀ ਹੈ, ਵੀਂ ਹਨ ਛੁਹਿਧਾਂ ਕੀ ਤਨ-ਘਵਾਹ ਪਾਅੰਗੇ। ਅਲਭਤਾ ਮੁਖ਼ਤਲਿਫ਼ ਅਲਾਕਾਂ ਕੇ ਏਤਿਬਾਰ ਸੇ ਉੱਝ ਮੁਖ਼ਤਲਿਫ਼ ਹੋ ਸਕਤਾ ਹੈ।

《36》 ਅਗਰ ਈਮਾਮ ਧਾ ਮੁਅਝਿੰਨ ਦਾ'ਵਤੇ ਈਸ਼ਾਮੀ ਕੇ ਤੀਨ ਦਿਨ ਕੇ

ੴ ਫਰਮਾਨੇ ਮੁਸਤਕਾ ﷺ : ਜਿਸ ਨੇ ਮੁੜ ਪਰ ਏਕ ਬਾਰ ਛੁਡੇ ਪਾਕ ਪਢਾ ਅਲਵਾਹ ਉੱਤੇ ਉਸ ਪਰ ਦਸ ਰਖਮਤੋਂ ਭੇਜਤਾ ਹੈ। (੮)

ਮ-ਦਨੀ ਕਾਫ਼ਿਲੇ ਮੌਜੂਦ ਸਫਰ ਕਰੋ ਤੋ ਕਮ ਅਤ ਕਮ ਏਕ ਦਿਨ ਕੀ ਤਨ-ਘਵਾਹ ਝੜ੍ਹਰ ਕਟਵਾਅਂ ਔਰ ਏਕ ਦਿਨ ਕੀ ਭੀ ਸਿੱਖ ਈਸੀ ਸੂਰਤ ਮੌਜੂਦ ਕੇ ਉਸ ਮਹੀਨੇ ਮੌਜੂਦ ਕਿਸੀ ਔਰ ਦਿਨ ਕੀ ਛੁਡੀ ਨ ਕਰੋ। ਅਥਵਾ ਗਰੜ ਮਾਹਾਨਾ ਦੀ ਛੁਡਿਆਂ ਕੇ ਈਲਾਵਾ ਜਾਈਦ ਛੁਡਿਆਂ ਕੀ ਤਨ-ਘਵਾਹ ਕਟਵਾ ਦੇ ਜਥੁਕੇ ਉੱਤੇ ਸਿੱਖ ਦੀ ਛੁਡਿਆਂ ਹੋ।

॥37॥ ਕਿਭੀ ਕਿਭੀ ਈਮਾਮ ਨਮਾਜ ਕੀ ਔਰ ਮੁਅਜ਼ਿਝਨ ਅਜਾਨ ਕੀ ਛੁਡੀ ਕਰ ਲਿਆ ਕਰਤੇ ਹੋਣੇ, ਐਸੇ ਮਵਾਕੇਅ ਪਰ ਵਹਾਂ ਕਾ ਉੱਝ (ਯਾਨੀ ਮਾ'ਮੂਲ) ਦੇਖਾ ਜਾਏਗਾ। ਅਗਰ ਈਸ ਤਰਹ ਕੀ ਛੁਡਿਆਂ ਪਰ ਵਹਾਂ ਕਟੋਤੀ ਨਹੀਂ ਕੀ ਜਾਂਦੀ ਤਾਂ ਤਾਂ ਨ ਕੀ ਜਾਂਦੇ ਵਰਨਾ ਕਰ ਲੀ ਜਾਏ।

॥38॥ ਮੁ-ਤਵਲਿਧਿਆਨੇ ਮਹਿਸੂਸਿਅਤ ਕੀ ਰਿੜਾ ਮਨੀ ਕੀ ਸੂਰਤ ਮੌਜੂਦ ਈਮਾਮ ਵ ਮੁਅਜ਼ਿਝਨ ਉੱਝ ਦੇ ਜਾਈਦ ਛੁਡਿਆਂ ਮੌਜੂਦ ਅਪਨਾ ਨਾਈਬ ਦੇ ਦਿਯਾ ਕਰੋ ਤੋ ਤਨ-ਘਵਾਹ ਨਹੀਂ ਕਾਟੀ ਜਾਏਗੀ।

॥39॥ ਹਮਾਰੇ ਧਹਾਂ ਉਮੂਮਨ ਮੁਅਜ਼ਿਝਨ ਦੇ ਸਾਰਾ-ਹਤਨ (ਯਾਨੀ ਵਾਯੇਹ ਤੌਰ ਪਰ) ਯਾ ਦਲਾ-ਲਤਨ ਤੈ (ਯਾਨੀ understood) ਹੋਤਾ ਹੈ ਕੇ ਵੋਹ ਈਮਾਮ ਕੀ ਗੈਰ ਹਾਜ਼ਿਰੀ ਮੌਜੂਦ ਪਢਾਏਗਾ, ਐਸੀ ਸੂਰਤ ਮੌਜੂਦ ਉਸ ਕੋ ਅਪਨਾ ਨਾਈਬ ਨਹੀਂ ਬਨਾ ਸਕਤਾ ਕਿਸੀ ਔਰ ਕੋ ਬਨਾਏ। ਦੂਸਰੇ ਕੋ ਨਾਈਬ ਬਨਾਨੇ ਦੇ ਮੁਅਜ਼ਿਝਨ ਯਾ ਈਜ਼ਿਆਮਿਆ ਖੁਸ਼ ਨ ਹੋਣੇ ਤੋ ਝੜ੍ਹਰੀ ਹੈ ਕੇ ਨਾਈਬ ਕੇ ਤਕਰੂਰ ਕੇ ਬਜਾਏ ਕਟੋਤੀ ਕਰਵਾਏ, ਅਲਭਤਾ ਯੇਹ ਸੂਰਤ ਹੋ ਸਕਤੀ ਹੈ ਕੇ ਮੁਅਜ਼ਿਝਨ ਸਾਹਿਬ ਔਰ ਈਜ਼ਿਆਮਿਆ ਦੇ ਮੁਸ਼ਾਵਰਤ ਕੇ ਬਾਂਦ ਕਿਸੀ ਕਾ ਬਤੌਰੇ ਨਾਈਬ ਤਕਰੂਰ ਕਰ ਲੇ।

॥40॥ ਈਮਾਮ ਵ ਮੁਅਜ਼ਿਝਨ ਸਾਲਾਨਾ ਕਮੋ ਬੇਸ਼ ਏਕ ਛੜਤੇ ਕੇ ਲਿਧੇ ਅਪਨੇ

﴿ਈਰਮਾਨੇ ਮੁਸਤਕਾ : ﷺ : ਜੋ ਸ਼ਾਖਸ ਮੁਜ ਪਰ ਹੁਵੇਂ ਪਾਕ ਪਥਨਾ ਭੂਲ ਗਯਾ ਵੋਹ ਜਨਨਾ ਕਾ ਰਾਸਤਾ ਭੂਲ ਗਯਾ। (بخاری)﴾

ਅੜੀਝੋ ਅਕਾਰਿਆ ਸੇ ਮਿਲਨੇ ਬੈਠ੍ਹੇ ਸ਼ਹੂਰ ਜਾ ਸਕਤੇ ਹੋਣ ਇਨ੍ਹਾਂ ਕੀ ਤਨ-ਘਵਾਹ ਕੇ ਛਕਦਾਰ ਰਹੇਂਗੇ।

﴿41﴾ ਈਮਾਮ, ਮੁਅਝਿਝਨ ਧਾ ਕਿਸੀ ਭੀ ਹੁਕਾਮ ਵਗੈਰਾ ਕਾ ਮੁਲਾਝਿਮ ਸਖ਼ਤ ਬੀਮਾਰ ਹੋ ਜਾਏ ਧਾ ਉਸ ਕੇ ਵਹਾਂ ਕੋਈ ਈਨਤਿਕਾਲ ਕਰ ਜਾਏ ਤੋ ਇਨ ਸੂਰਤਾਂ ਮੌਹਨੇ ਵਾਲੀ ਛੁਡਿਆਂ ਮੌਹਨੇ ਵਹਾਂ ਕਾ ਉੱਝੇਬਾ ਜਾਏਗਾ। ਅਗਰ ਤਨ-ਘਵਾਹ ਕਾਟਨੇ ਕਾ ਉੱਝੇਬਾ (ਧਾ'ਨੀ ਮਾ'ਮੂਲ) ਹੈ ਤੋ ਕਾਟ ਲੀ ਜਾਏ ਵਰਨਾ ਨ ਕਾਟੀ ਜਾਏ।

﴿42﴾ ਈਮਾਮ ਧਾ ਮੁਅਝਿਝਨ ਧਾ ਮੁਦਰਿਸ ਧਾ ਕਿਸੀ ਮੁਲਾਝਿਮ ਕਾ ਘਰ ਫੁਰੈ ਹੈ, “ਪਥਾ ਜਾਮ ਹਤਾਲ” ਕੀ ਵਜ਼ਹ ਸੇ ਸੁਵਾਰੀ ਨ ਮਿਲੀ ਧਾ ਹੁੰਗਾਮੋਂ ਕੇ ਸਹੀਹ ਖੌਫ਼ ਕੇ ਸਬਥ ਛੁਡੀ ਹੋ ਗਈ ਤੋ ਅਗਰ ਪਹਲੇ ਸੇ ਤੈ ਹੋ ਗਿਆ ਥਾ ਕੇ ਐਸੇ ਮਵਾਕੇਅ ਪਰ ਤਨ-ਘਵਾਹ ਨਹੀਂ ਕਾਟੀ ਜਾਏਗੀ। ਧਾ ਵਹਾਂ ਕਾ ਉੱਝੇਬਾ (ਧਾ'ਨੀ ਮਾ'ਮੂਲ) ਹੀ ਐਸਾ ਹੋ ਕੇ ਐਸੇ ਮਵਾਕੇਅ ਪਰ ਕਟੋਤੀ ਨਹੀਂ ਹੋਤੀ ਤੋ ਇਸ ਤਰਹ ਕੀ ਛੁਡੀ ਕੀ ਤਨ-ਘਵਾਹ ਪਾਏਗਾ। ਧਾਇ ਰਹੇ ! ਮਾ'ਮੂਲੀ ਹਤਾਲ ਛੁਡੀ ਕੇ ਲਿਧੇ ਉੜ੍ਹਰ ਨਹੀਂ।

﴿43﴾ ਹਜ ਧਾ ਉੰਚੇ ਕੀ ਵਜ਼ਹ ਸੇ ਹੋਨੇ ਵਾਲੀ ਛੁਡਿਆਂ ਕੀ ਤਨ-ਘਵਾਹ ਕਟਵਾਨੀ ਹੋਗੀ। (ਫਿਲਿਪ : ਫਿਤਾਵਾ 2-ਅਵਿਧਾ ਜਿਲਦ 16 ਸਫ਼ਲਾ 209)

﴿44﴾ ਅਗਰ 28 ਤਾਰੀਖ ਕੋ ਤਕੋ ਮੁਲਾ-ਅਮਤ ਕੀ ਤੋ (ਹਿਜਰੀ ਸਿਨ ਕੇ ਮਾਹ ਕੇ ਏਤਿਥਾਰ ਸੇ ਨੋਕਰੀ ਹੋ ਤੋ) ਬਕਿਧਾ ਅਥਾਮ ਮ-ਸਲਨ ਏਕ ਦੀ ਦਿਨ ਧਾ (ਈ-ਸਵੀ ਸਿਨ ਕੇ ਮਾਹ ਕੇ ਏਤਿਥਾਰ ਸੇ ਨੋਕਰੀ ਹੋ ਤੋ) ਬਕਿਧਾ ਤੀਨ ਦਿਨ ਕੀ ਤਨ-ਘਵਾਹ ਕਾ ਮੁਸਤਹਿਕ ਨਹੀਂ।

﴿45﴾ ਨਿਅ ਈਦਾਰੇ ਕੇ ਸੇਠ ਧਾ ਉਸ ਕੇ ਨਾਈਬ ਕੀ ਈਜਾਜਤ ਸੇ ਕਾਮਕਾਜ ਕੇ

ફરમાને મુસ્તકા. ﴿١٣﴾ : حَلَّ اللَّهُ بَعْنَاهُ عَلَيْهِ وَبِرَحْمَةِ رَبِّهِ وَبِسْمِ رَبِّ الْعَالَمِينَ : જિસ કે પાસ મેરા જિક હુવા ઓર ઉસ ને મુજ પર હુરંગ પાક ન પઢા તહીક
વોહ બદ બખ્ત હો ગયા. (હિન્દુ)

અવકાત મેં મુલાઝિમ સુન્તતે જૈર મુખક્કદા, નવાફિલ ઔર દીગર અજકાર પછ સકતા નીજ ઈજાજત કે સાથ હી દર્સ, સુન્તતોં ભરે ઈજાતિમાઅ વગૈરા મુસ્તહબ કામોં મેં શિર્કત કર સકતા હૈ.

﴿46﴾ ચોકીદાર, ગાઈ યા પોલીસ વગૈરા જિન કા કામ જાગ કર પહરા દેના હોતા હૈ અગર ઝ્યૂટી કે અવકાત મેં ઈરા-દતન સો ગયે તો ગુનહગાર હોંગે ઔર (કસ્ટન યા બિલા કસ્ટ) જિતની દેર સોએ યા ગાફિલ હુએ ઉતની દેર કી ઉજરત કટવાની હોગી.

﴿47﴾ મુલાઝિમીન કા મુતા-લબાત મન્જૂર કરવાને યા કુછ હાલાત બેહતર કરવાને કે લિયે કામ કરને સે ઈન્કાર કરતે હુએ હડતાલ કરના (યા'ની કામ સે રૂકના), મુલાઝિમ ઔર માલિક કે માબૈન મુઆ-હદે કી બિલાફ વર્જી હૈ ઐસા કરના મન્ય હૈ.

﴿48﴾ એક હી વક્ત કે અન્દર દો જગહ નોકરી કરના યા'ની ઈજારે પર ઈજારા કરના ના જાઈજ હૈ. અલબતા અગર વોહ પહલે હી સે કહીનોકરી પર લગા હુવા હૈ તો અથ અપને સેઠ કી ઈજાજત સે દૂસરી જગહ કામ કર સકતો હૈ, જબ કે પહલી જગહ કે સબબ દૂસરી જગહ કે કામ મેં કિસી તરહ કી કોતાણી ન હોતી હો.

﴿49﴾ ઉર્ફ કે મુતાબિક જો છુદ્વી હોતી હૈ ઉસ મેં મુસ્તાજિર (સેઠ) અપને મુલાઝિમ સે કામ નહીં લે સકતા અગર જબ્રન લેગા તો ગુનહગાર હોગા. હાં હુક્મિયા લહજે મેં નહીં ફકત દર-ઘ્વાસ્ત કરને પર મુલાઝિમ ખુશાદિલી સે કામ કર દે યા છુદ્વી કે અવકાત મેં કિયે જાને વાલે કામ કી બાહ્ય અલગ સે ઉજરત તૈ કર લી જાએ તો

ફરમાને મુસ્તફા ﷺ : જિસ ને મુજ પર એક બાર હુરુટે પાક પથા અલ્લાહ ઉસ પર દસ રહ્મતે બેજતા હૈ. (م)

ક્રિએ જાઈજ હૈ. યેહ કાઈદા યાદ રખયે ! જહાં દલા-લતન (યા'ની અલામત સે મા'લૂમ. understood) યા સરા-હતન (યા'ની ખુલ્લમ ખુલ્લા, ઝાહિરન) ઉજરત સાબિત હો વહાં તૈ કરના વાજિબ હૈ. ઐસે મૌકાએ પર તૈ કરને કે બજાએ ઈસ તરહ કહ દેના : કામ પર આ જાઓ દેખ લેંગે, જો મુનાસિબ હોગા દે દેંગે, ખુશ કર દેંગે, ખર્ચી ભિલેગી વગેરા અલ્ફાજ કત્સન નાકાફી હું. બિગેર તે કિયે ઉજરત લેના દેના ગુનાહ હૈ, તે શુદા સે ઝાઈદ તલબ કરના ભી મમ્નૂઅ હૈ. યેહ કાઈદા રિક્શા ટેક્સી કે ડ્રાઇવરોં, હર તરહ કે કારીગરોં વગેરા ઔર ઈન સે કામ કરવાને વાલોં કો યાદ રખના ઝરુરી હૈ. અલબત્તા જહાં ફરીકૈન કો લગી બંધી (યા'ની fix) ઉજરત યા કિરાએ કા મા'લૂમ હો વહાં તૈ કરને કી હાજત નહીં નીજ જહાં ઐસા મુઆ-મલા હો કે કામ કરવાને વાલે ને કહા : કુછ નહીં દૂંગા, ઈસ ને ભી કહ દિયા કુછ નહીં લુંગા ઔર ક્રિએ અપની મરજી સે દે દિયા તો ઈસ લૈન દૈન મેં કોઈ હરજ નહીં.

«50» મજદૂરી યા ડ્યૂટી મેં સુસ્તી ઔર ધૃહિયોં કે બા વુજૂદ જો મુક્ખમલ ઉજરત યા તન-ખ્વાહ લેતા રહા ઔર અબ નાદિમ હૈ તો ઉસ કે લિયે સિર્જ જબાની તૌબા કાફી નહીં, તૌબા કરને કે સાથ સાથ આજ તક જિતની ઉજરત યા તન-ખ્વાહ ઝાઈદ હાસિલ કી હૈ ઉસ કી ભી શર-ઈ તરકીબ કરની હોગી. ચુનાન્યે ઈસ મરસ્ખલે કા હલ બયાન કરતે હુએ મેરે આકા આ'લા હજરત ફરમાતે હું : (જિતના કામ કિયા) ઉસ સે જો કુછ જિયાદા મિલા (હો વોહ)

ફરમાને મુસ્તફા : ﷺ : જો શખ્સ મુજ પર હુરેટ પાક પઢના ભૂલ ગયા વોહ જન્નત કા રાસ્તા ભૂલ ગયા. (بخارى)

મુસ્તાજિર (યા'ની જિસ ને ઉજરત પર રખા ઉસી) કો વાપસ (લૌટા) દે, વોહ ન રહા હો (તો) ઉસ કે વારિસોં કો દે, ઉન કા ભી પતા ન ચલે (તો) મુસ્લિમાન મોહત્તાજ (યા'ની મુસ્લિમાન ફકીર યા મિસ્કીન) પર તસદુક (યા'ની ઐરાત) કરે. અપને સર્ઝ (યા'ની ઇસ્તિ'માલ) મેં લાના યા ગૈરે સ-દકા મેં સર્ઝ (ખર્ચ) કરના હરામ હૈ. (ફિતાવા ૨-જવિયા, જિ. 19, સ. 407) વક્ફ કે ઈદારે મેં બહાર હાલ વાપસ હી કરની હોણી અગર રકમ યાદ નહીં તો જન્નત ગાલિબ કે હિસાબ સે માલિય્યત તૈ કર કે બયાન કર્દા હુકમે શર-ઈ પર અમલ કીજિયે. યાદ રખિયે ! પરાયા માલ ના જાઈજ તરીકે પર ખા ડાલના મહશર મેં ફંસા સકતા હૈ ચુનાન્યે ફરમાને મુસ્તફા હૈ : “જો શખ્સ પરાયા માલ લે લેગા વોહ કિયામત કે દિન અલ્લાહ ઉર્ગ ઓહ સે કોઢી હો કર મિલેગા.”

નોટ : યેહ રિસાલા “મુલાજિમીન કે

(النَّعْجَمُ الْكَبِيرُج ١ص ٢٣٣ حديث ٦٢٧)

લિયે 21 મંદની ફૂલ” પહલી બાર

તાલિબે ગમે મદ્દિના વ

3 જુમાદલ ઉલા 1427 સિ.હિ.

બકીઅ વ મજિફરત વ

(બ મુતાબિક મર્દ 2006 ઈ.) કો મન્જરે

બે હિસાબ જન્તુલ

આમ પર આયા ઔર કઈ બાર શાઅએઅ

ફિરદૌસ મેં આકા

કિયા ગયા ફિર મળીએ તરમીમ વ ઠંડાફે

કા પડોસ

કે સાથ તબ્બ હુવા. જુમાદલ ઉલા

જુમાદલ ઉલા 1434 સિ.હિ.

1434 સિ.હિ. (બ મુતાબિક માર્ચ

માર્ચ 2013 ઈ.

2013 ઈ.) મેં ઈસ પર નજરે સાની કી.



ફરમાન મુસ્તફા : ﷺ કિસ કે પાસ મેરા જીવા ઓર ઉસ ને મુજ પર હુર્દ પાક ન પણ તહકીક
યોહ બાદ બખ્ત હો ગયા. (અનુ.)

માન્દ મારાખ

કાબ	માન્દ	કાબ	માન્દ
ત્રાણ મજિદ	સ્ક્લેપીન્ડ બાબ દીની ક્રાચી	દાર અફ્રીયેરોટ	મન્ડામાન અહેન ખની
નોર અર્વાન	દીની ખાની ક્રાચી મ્રકર આઓલિયા લાહોર	તારન અંગરા	દીની ખાની ક્રાચી
ખારી	દાર અલ્ટીચી યીરોટ	ડ્રુટાર	દાર અલ્ટીચી યીરોટ
સ્લેમ	દાર એન્ઝ્રમ યીરોટ	રોલ્ટાર	દાર એન્ઝ્રમ યીરોટ
તર્ન્ડી	દાર અફ્રીયેરોટ	ફાલોઈ રષ્યોય	રશાફ ક્રાચીયિશન મ્રકર આઓલિયા લાહોર
અની બાજ	દાર અલ્ટીચી યીરોટ	બેહાર્શાયિત	મલુકીની મદ્દીય બાબ દીની ક્રાચી
ભેંગ ક્રીય	દાર એચાઇ એટ્રાથ અર્વી યીરોટ	અહીંએલોમ	દાર એચાઇ એરોટ
ભેંગ ઓસ્ટ	દાર અલ્ટીચી યીરોટ	મ્યાન્ફેન્ડ લ્યાટુબ	દાર અલ્ટીચી યીરોટ

યેહ રિસાલા પટ કર દૂસરે કો દે દીજિયે

શાહી ગમી કી તકરીબાત, ઈજાતિમાઆત, આ'રાસ ઔર જુલસે મીલાદ વગૈરા મેં મક-ત-બતુલ મદીના કે શાખેએ કર્દી રસાઈલ ઔર મ-દની ફૂલોં પર મુશ્તમિલ પેમફલેટ તકસીમ કર કે સવાબ કર્માઈયે, ગાહકોં કો બનિય્યે સવાબ તોહફે મેં દેને કે લિયે અપની દુકાનોં પર ભી રસાઈલ રખને કા મા'મૂલ બનાઈયે, અખાર ફરોશોં યા બચ્યોં કે ઝરીએ અપને મહલે કે ઘર ઘર મેં માણના કમ અગ્ર કમ એક અદદ સુન્તાંનો ભરા રિસાલા યા મ-દની ફૂલોં કા પેમફલેટ પહોંચા કર નેકી કી દા'વત કી ધૂમેં મચાઈયે ઔર ખૂબ સવાબ કર્માઈયે.

નામ રિસાલા : હલાલ તરીકે સે કમાને કે 50 મ-દની ફૂલ

પહલી બાર : શા'બાનુલ મુઅગ્રૂજમ 1434 સિ.લિ., જૂન 2013 ઈ.

તા'દાદ : 5000

નાશિર : મક-ત-બતુલ મદીના, ફેઝાને મદીના, ગ્રી કોનિયા બગીચે કે સામને,
મિરજાપુર, અહમદાબાદ-1, ગુજરાત, ઈન્દ્રિયા

મ-દની ઈલિજા : કિસી ઔર કો યેહ રિસાલા છાપને કી ઈજાત નહીં હૈ.

الحمد لله رب العالمين والصلوة والسلام على سيد المرسلين أباً المؤمن العظيم عليه وآله وآل بيته ورضي الله عنهما والرهقان الرشيق

શક્તાંત વાજિબ હો ગઈ



ફરમાને મુસ્તાફા : ﷺ : مَنْ أَتَى اللَّهَ بِمَا مَأْتَى فَلَمْ يُنْهَى عَنِ الْمُرْسَلِينَ إِنَّمَا يُنْهَى عَنِ الْمُرْسَلِينَ الَّذِينَ لَا يَعْمَلُونَ

”اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ
وَأَنْزِلْهُ الْمُقْعَدَ الْمُقْرَبَ
عِنْدَكَ يَوْمَ الْقِيَامَةِ“

ઉસ કે લિયે મેરી શક્તાંત વાજિબ હો ગઈ.

(تفہیم کبیر ج ۵ ص ۲۵ حديث ۱۱۸)

૧ : એ અલ્લાહ કરેલું હજરતે મુહમ્મદ પરિસરમાં તુલાદાન કરેલું હજરતે મુહમ્મદ પરિસરમાં નાજિલ કરમા ઓર ઉન્ડે કિયામન કે રોજ અપની બારગાડ મેં મુકર્બની મકામ અલા કરમા.



મક-ત-ખતુલ મદીના ®
દાવતે ઇસ્લામી

કિગાળો મદીના, ગ્રે કોલિયા બજીરે કે સામને, મિશાઘર, અનમદાનાબાદ, ગુજરાત, ઇન્ડિયા
Mo.091 93271 68200 E-mail : maktabaahmedabad@gmail.com www.dawateislami.net